

ત્વરિત જાહેરાત માટે

**સીટી ઓફ બ્રેમ્પટન મનાવશે સપ્ટેમ્બર 30 ના રોજ સત્ય અને સમાધાનનો રાષ્ટ્રીય દિન (National Day for Truth and Reconciliation)
અને ઓરેન્જ શર્ટ ડે (Orange Shirt Day)**

બ્રેમ્પટન, ઓન્ટારિયો (17 સપ્ટેમ્બર 2021) – આ અઠવાડિયે, બ્રેમ્પટન સીટી કાઉન્સિલે સર્વાનુમતે કેનેડાના સહુ પ્રથમ સત્ય અને સમાધાન રાષ્ટ્રીય દિનને સપ્ટેમ્બર 30ના રોજ ઔપચારિક રીતે સ્થાન આપવા ઠરાવ્યું.

તમામ સિટી સવલતો બંધ રહેશે અને ટ્રાન્ઝિટ સેવાઓ રવિવાર/રજાના સમયપત્રક મુજબ દોડશે, જેથી તમામ કર્મચારીઓ અને રહેવાસીઓને સિટી અને સમુદાયની પ્રવૃત્તિઓ અંગે અભિપ્રાયોનું આદાનપ્રદાન, અવલોકન કરવાની તક છે તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત થાય.

બ્રેમ્પટનમાં સત્ય અને સમાધાનનો રાષ્ટ્રીય દિન અને ઓરેન્જ શર્ટ ડેનું પ્રોગ્રામિંગ

સત્ય અને સમાધાન સપ્તાહ માટે સપ્ટેમ્બર 27 થી ઓક્ટોબર 1 સુધી એવરી ચાઇલ્ડ મેટર્સ (Every Child Matters)નો ધ્વજ ફરકાવીને સિટી સત્ય અને સમાધાનનો રાષ્ટ્રીય દિન અને ઓરેન્જ શર્ટ ડે મનાવશે. સપ્ટેમ્બર 30ના રોજ, બધા ધ્વજ અડધી કાઠીએ ફરકશે અને બ્રેમ્પટન સીટી હોલ ક્લોક ટાવરને નારંગી રંગે રોશન કરાશે.

જાણકારીની સતત પ્રાપ્તિને પ્રોત્સાહિત કરવા માટે, સિટી એવી એક વેબસાઇટ www.brampton.ca/bramptonremembers ઉપલબ્ધ કરાવશે જેમાં કર્મચારીઓ અને જાહેર જનતા માટે વિશ્વસનીય અને સુગમ સંસાધનો હશે.

બ્રેમ્પટનના ઈવેન્ટ્સ કેલેન્ડરમાં તેમના સપ્ટેમ્બર 30મીના કાર્યક્રમો રજૂ કરવા માટે સીટી ઓફ બ્રેમ્પટન સમાજના જૂથો અને અગ્રણીઓને પણ આમંત્રણ પાઠવે છે.

સત્ય અને સમાધાનનો રાષ્ટ્રીય દિન વિષયક

જુન 2021માં કેનેડા સરકારે સત્ય અને સમાધાનનો રાષ્ટ્રીય દિન તરીકે ઓળખાતી સંઘીય કર્મચારીઓ માટેની નવી જાહેર રજા સ્થાપિત કરવા માટે બિલ C-5 ને બહાલી આપી.

આ નવી રજા કેનેડાના સત્ય અને સમાધાન કમિશનના 94 કાર્યવાહી કરવા માટેના કોલ પૈકી કાર્યવાહી ક્રમાંક 80 છે. આ દિને ફર્સ્ટ નેશન્સ, ઈનુઈટ અને મેટિસ સમાજના લોકો, તેમના પરિવારો અને સમાજનું બહુમાન કરાશે અને તે ખાતરી કરવા કે સમાધાન પ્રક્રિયા માટે તેમના ઈતિહાસ અને રેસિડેન્સિયલ શાળાઓની ધરોહરનું જાહેર સન્માન એક મહત્વપૂર્ણ ઘટક રહે.

લિંક:

- [સીટી ઓફ બ્રમ્પટન – બ્રમ્પટન રિમેમ્બર્સ \(Brampton Remembers\)](#)
- [સિટી ઓફ બ્રમ્પટન – ઈવેન્ટ્સ કેલેન્ડર](#)
- [કેનેડાનું સત્ય અને સમાધાન કમિશન\(Truth and Reconciliation Commission of Canada\) \(TRC\)](#)
- [કેનેડા સરકારનો ઓનલાઇન ઈવેન્ટ - સત્ય અને સમાધાનનો રાષ્ટ્રીય દિનને ટાંકી રાખો](#)
- [કેનેડા સરકાર – સંઘીય વૈધાનિક રજા:સત્ય અને સમાધાનનો રાષ્ટ્રીય દિન](#)
- [કેનેડા સરકાર – બિલ C-5 \(સત્ય અને સમાધાનનો રાષ્ટ્રીય દિન\)](#)
- [સત્ય અને સમાધાનનું રાષ્ટ્રીય કેન્દ્ર](#)
- [ઓરેન્જ શર્ટ ડે](#)

સુવાક્યો

“અમે જ્યારે સત્ય અને સમાધાનનો રાષ્ટ્રીય દિન અને ઓરેન્જ ડે સપ્ટેમ્બર 30ના રોજ મનાવી રહ્યા છીએ ત્યારે સિટી ઓફ બ્રમ્પટન મૂળનિવાસી લોકો અને તેમના સમાજ સાથે સત્ય અને સમાધાન હાંસલ કરવાના હેતુથી વધુ જવાબદારી સ્વીકારવા તરફ અર્થપૂર્ણ પગલાં લેવા પુનઃ સમર્પિત થાય છે. આ વર્ષના પૂર્વાધમાં ભૂતપૂર્વ રહેણાક શાળાના સ્થળો પર ભયાનક બાબતો પ્રકાશમાં આવી તે એક શહેર, સમુદાય અને દેશ તરીકે અમને તે બાકી રહેલ મહત્વપૂર્ણ કાર્યવાહીઓ કરવાની યાદ અપાવે છે. હું સર્વેજનને સિટી અને સમુદાયના નેજા હેઠળ સપ્ટેમ્બર 30ના રોજ થનાર પ્રોગ્રામિંગમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરું છું જેથી તેના પર વિચાર કરી શકાય અને તે સ્મૃતિમાં રહે.”

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"એક સંગઠન તરીકે સત્ય અને સમાધાનના રાષ્ટ્રીય દિનને એક ઔપચારિક રીતે પાલન કરવાના દિન તરીકે સ્થાપિત કરવો એટલે મૂળનિવાસી સમુદાયો સાથે સત્ય અને સમાધાનને સમર્થન આપતું પગલું ગણી શકાય. અમારી ટીમ તે બાબતની ખાતરી કરવા સમર્પિત છે કે કર્મચારીઓ, રહેવાસીઓ અને સમુદાયના સભ્યોને અર્થપૂર્ણ રીતે અભિપ્રાયો આપીને આ અગત્યના દિવસમાં સહભાગી થવાની તક સાંપડે જેથી તેઓ માટે સંસાધનો અને પ્રોગ્રામિંગ સુગમ બને.

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રમ્પટન

"સત્ય અને સમાધાનના રાષ્ટ્રીય દિન અંગે પ્રવૃત્તતાયુક્ત સંવાદ અને અભિપ્રાયોના આદાનપ્રદાન મારફત અમે એવા સંબંધો સ્થાપવા તરફ આગળ વધી શકીશું જેનો આધાર પરસ્પર આદર, વિશ્વાસ અને મૂળનિવાસી લોકો સાથે કેનેડાના સમાધાનની જવાબદારીની સ્વીકૃતિ પર છે. એક શહેર અને સમુદાય તરીકે આપણે સહુ એક એવો સમાજ નિર્માણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી શકીએ છીએ જે વધુ કડ્ડણા, સમાવેશિતા

અને સમાનતાયુક્ત હોય. હું બધાને ઇવેન્ટ્સની શ્રેણી અને પ્રોગ્રામિંગમાં સહભાગી થવા પ્રોત્સાહિત કરું છું જે સિટી દ્વારા કેનેડામાં સમાયેલ મૂળનિવાસી સમુદાયોના ઈતિહાસને આદર અને સન્માન આપવા તથા સપ્ટેમ્બર 30ના રોજ અભિપ્રાયોના આદાનપ્રદાન કરવા માટે હાથ ધરવામાં આવનાર છે."

-મિશેલ બર્ન, મેનેજર, ઈક્વિટી ઓફિસ, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca